

સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓની વિગત

સુરત રેન્જના જીલ્લાઓ નવસારી, સુરત ડુરલ, વલસાડ, ડાંગ, તાપી જીલ્લા પોલીસના કર્મચારીઓ ધ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા એજ સેવા“ પખવાડીયા ઉજવણી તા.

૧૭.૦૯.૨૦૧૭ થી ૦૨.૧૦.૨૦૧૭ સુધી ઐતિહાસીક સ્થળ દાંડી દરિયા કિનારો, સૈફીવિલા, પ્રાર્થના મંદિર વિગેરે સ્થળોની સફાઈ કરી તા. ૦૨.૧૦.૨૦૧૭ ના રોજ બેસ્ટ સ્વચ્છ પોલીસ સ્ટેશન-૧-૨-૩, બેસ્ટ પોલીસ લાઇન-૧-૨-૩ તેમજ અન્ય વિજેતાઓને સન્માનીત કરવામાં આવ્યા.

## રેન્જ પાલાસ દાંડીમા સફાઈ અભિયાન થકી રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ આપી

**રેન્જ આઈજીએ દરિયાકાંઠે બનેલ વોચ ટાવરનું લોકાર્પણ કર્યું : સફાઈ અભિયાન બાદ ૩ કિમીનો બીચ રનનો કાર્યક્રમ યોજાયો**

**નવસારી**  
સુરત રેન્જ પોલીસ દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપવા ઐતિહાસિક દાંડી ખાતે સફાઈ અભિયાન હાથ પરાયું હતું, જેની આજે ગાંધી જયંતિ નિમિત્તે પૂર્ણાહૂતિ થઈ હતી. આ પ્રસંગે દાંડીના દરિયા કિનારા ઉપર વોચ ટાવરનું લોકાર્પણ સુરત રેન્જ આઈ.જી.ડી.શમશેર સિંઘે કર્યું હતું.

સુરત રેન્જ પોલીસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અંતર્ગત ઐતિહાસિક દાંડી ખાતે સ્વચ્છતા એજ સેવા પખવાડીયાની ઉજવણી ૧૭ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનથી પ્રારંભ કરી ૨ જી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનનો પ્રારંભ ૧૭ મી સપ્ટેમ્બરે સુરતના રેન્જ આઈ.જી.ડી.શમશેર સિંઘે કરાવ્યો હતો. પખવાડીયા દરમિયાન પોલીસના વિવિધ ખાતાઓ દ્વારા ઐતિહાસિક દાંડીના દરિયા કિનારાની અંદરથી લઈ સૈફીવિલા સુધી બે કિ.મી.ના રોડની બંને બાજુએ દરરોજ સવારે બે કલાક સફાઈ અભિયાન હાથ પરાવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનને



સફળ બનાવવા પોલીસની સાથે વિવિધ એન.જી.ઓ.સંસ્થા તથા નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા. પખવાડીયાના અંતે દરિયા કિનારાની અંદર ઓવારની ઉત્તર તથા દક્ષિણ દિશા તરફ બે-બે કિ.મી.ના અંતર સુધી એટલે કે કુલ ચાર કિ.મી.ની સફાઈ પોલીસ ખાતા દ્વારા કરી દાંડી બીચને સ્વચ્છતાની એક અનોખી ભેટ પરાવામાં આવી હતી. પોલીસ ખાતાની આ અનોખી પહેલાના કારણે સ્વચ્છતા એજ સેવાનું સુન આજે દાંડી ખાતે સાર્થક થયેલું જોઈ શકાય છે. તે ઉપરાંત દરિયા કિનારથી લઈ નમક સત્યાગ્રહ સ્મારક સ્થિત સૈફીવિલા સુધીના ૨ કિ.મી. અંતર સુધી રોડની બંને બાજુના વિસ્તારમાં પણ સફાઈ અભિયાન હાથ પરાતા આ

વિસ્તાર પણ સ્વચ્છ અને સુંદર બની જવા પામ્યો છે. સફાઈ અભિયાનના પૂર્ણાહૂતિ પ્રસંગે ૩.કિ.મી.નો બીચ રનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પોલીસ વિભાગ સહિત ૮૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ બીચ રન ને નવસારીના ડી.એસ.પી.એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તે ઉપરાંત પ્રાર્થના મંદિર ખાતે યોજાયેલા પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં બીચ રનના વિજેતા તથા બિન તેમજ બિનમ સ્પર્ધાના વિજેતાઓને પોલીસ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વોચ ટાવરના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.





### મુદા નંબર (૧)

- જીલ્લા કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે. વિડીયો કોન્ફરન્સ, સેટકોમ કાર્યક્રમ યોજવામાં આવેલ.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી ડુરલ, જલ્લાલપોર વિસ્તારમાં તાલીમ બધ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

### મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.

### મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

### મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

સુરત રેન્જના જીલ્લાઓ નવસારી, સુરત ડુરલ, વલસાડ, ડાંગ, તાપી જીલ્લા પોલીસના કર્મચારીઓ ધ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા એજ સેવા“ પખવાડીયા ઉજવણી તા.

૧૭.૦૯.૨૦૧૭ થી ૦૨.૧૦.૨૦૧૭ સુધી ઐતિહાસીક સ્થળ દાંડી દરિયા કિનારો, સૈફીવિલા, પ્રાર્થના મંદિર વિગેરે

स्थळीनी सङ्गळ करी ता. ०२.१०.२०१७ ना रोज बेस्ट स्वच्छ पोलीस स्टेशन-१-२-३, बेस्ट पोलीस लाँन-१-२-३ तेमज अन्य विजेताओने सन्मानीत करवामां आव्या